

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**Diploma Semester –V<sup>th</sup> Examination December - 2010**Subject code: 350502****Subject Name: Mass Transfer-II****Date: 27 /12 /2010****Time: 02.30 pm – 05.00 pm****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is Authentic

<b>Q.1</b>	(a) Differentiate Azeotropic distillation Vs Extractive distillation (b) Explain psychometric chart for Air-water system in humidification	<b>07</b> <b>07</b>
<b>Q.2</b>	(a) Define Crystallization. Explain Supersaturation and methods to get it. (b) Discuss operating problems in tray tower.	<b>07</b> <b>07</b>
	<b>OR</b>	
	(b) Discuss operating problems in packed tower.	<b>07</b>
<b>Q.3</b>	(a) State and explain (i) Rault's Law (ii) Henry's Law (b) Classification of drying equipments.	<b>07</b> <b>07</b>
	<b>OR</b>	
<b>Q.3</b>	(a) Flash Vaporization with material balance. (b) Derivation of equation for constant rate period and falling rate period.	<b>07</b> <b>07</b>
<b>Q.4</b>	(a) Explain vapor-liquid equilibrium and enthalpy for pure substance in humidification. (b) Write short note on Higgins contactor.	<b>07</b> <b>07</b>
	<b>OR</b>	
<b>Q. 4</b>	(a) State principles and types of cooling towers. (b) State Freundlich equation. Discuss adsorption of solute from dilute solution and concentrated solution.	<b>07</b> <b>07</b>
<b>Q.5</b>	(a) Discuss vacuum crystallizer in detail. (b) Differential distillation with Rayleigh's equation.	<b>07</b> <b>07</b>
	<b>OR</b>	
<b>Q.5</b>	(a) Discuss draft tube baffle crystallizer in detail. (b) State types of adsorption and explain characteristics of adsorbents.	<b>07</b> <b>07</b>

<b>પ્રશ્ન-૧</b>	અ તફાવત આપો એક્ઝિઓટ્રોપિક ડિસ્ટીલેશન અને એક્ષ્ટ્રેક્ટીવ ડિસ્ટીલેશન.	<b>07</b>
	બ છુમિડીફિકેશન માં એર-વોટર સિસ્ટમ નો સાઇકોમેટ્રિક ચાર્ટ વર્ણવો.	<b>07</b>
<b>પ્રશ્ન-૨</b>	અ કિસ્ટેલાઇજેશન સમજાવો. સુપર સેચ્યુરેશન અને તેને મેળવવા ની રીત વર્ણવો.	<b>07</b>
	બ ટ્રે - ટાવર ના ઓપરેટીંગ પ્રોબ્લેમ ની ચર્ચા કરો.	<b>07</b>
	<b>અથવા</b>	
	બ પેક ટાવર ના ઓપરેટીંગ પ્રોબ્લેમ ની ચર્ચા કરો.	<b>07</b>

<b>પ્રશ્ન-૩</b>	અ લખો અને સમજાવો (1) રાઉલ્ટ નો નિયમ (2) હેનરી નો નિયમ બ ડ્રાયિંગ ના સાધનો નું વર્ગીકરણ કરો.	<b>07</b>
	અથવા	
<b>પ્રશ્ન-૪</b>		
	અ મટીરીયલ બેલેસ સાથે ફ્લેશ વેપોરાઇઝેશન. બ કોસ્ટટ રેટ પિરીયડ અને ફોલિંગ રેટ પિરીયડ માટે સુત્ર તારવો.	<b>07</b>
<b>પ્રશ્ન-૫</b>		
	અ વેપર-લિકવીડ ઇકવીલીબીયમ અને હ્યુમિડીફિકેશન મા શુષ્ક પદાર્થ ની એંથાલ્પી સમજાવો. બ ટુંક નોંધ લખો “હીંગ્વીસ કોટેક્ટોર”.	<b>07</b>
	અથવા	
<b>પ્રશ્ન-૬</b>		
	અ ફૂલીંગ ટાવર ના પ્રકારો અને સિઝાંત લખો. બ ફેદ્લીચ નું સુત્ર લખો. દ્રાવક ના મંદન કરેલ દ્રાવણ અને સાંક્રાન્ત દ્રાવણ ના અધિશોષણ ની ચર્ચા કરો.	<b>07</b>
<b>પ્રશ્ન-૭</b>		
	અ વેક્યુમ કીસ્ટેલાઇજર ની વિસ્તૃત ચર્ચા કરો. બ રેયલેઇધ સુત્ર સાથે ડીફરન્સિલ ડિસ્ટીલેશન.	<b>07</b>
	અથવા	
<b>પ્રશ્ન-૮</b>		
	અ ડ્રાફ્ટ ટ્યુબ-બફેલ કીસ્ટેલાઇજર ની વિસ્તાર મા ચર્ચા કરો. બ અધિશોષણ ના પ્રકારો લખો. અધિશોષણ ની લાક્ષણિકતા સમજાવો.	<b>07</b>

\*\*\*\*\*